

B.Com. Semester - 6 (CBCS) Examination

March/April -2020

AUDITING AND CORPORATE GOVERNANCE -2(DSE-1)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-1 (A) ચકાસણી એટલે શું? તેના ઉદ્દેશો અને મહત્વ સમજાવો. (10)
- (B) મિલકતોની ચકાસણી અને મૂલ્યાંકન અંગે ઓડિટરની ફરજો જણાવો. (10)
- અથવા
- પ્રશ્ન-1 નીચેનાની ચકાસણી અને મૂલ્યાંકન કરો. (કોઈપણ ચાર) (20)
- (૧) સંભવિત જવાબદારી (૨) પેટન્ટ (૩) આખર સ્ટોક
- (૪) પાઘડી (૫) રોકાણો (૬) તારણવળી લોન
- પ્રશ્ન-2 (A) વહેંચણીપાત્ર નફો એટલે શું? તેને અસર કરતા પરિબલો જણાવો. (10)
- (B) ડિવીડન્ડ અને વચગાળાનું ડિવીડન્ડ સમજાવો. (10)
- અથવા
- પ્રશ્ન-2 (A) ડિવીડન્ડનો અર્થ આપી ડિવીડન્ડ અંગે ઓડિટરની ફરજો જણાવો. (10)
- (B) વહેંચણીપાત્ર નફા અંગે ઓડિટરની ફરજો જણાવો. (10)
- પ્રશ્ન-3 ઓડિટરના અહેવાલના પ્રકારો વિસ્તારપૂર્વક જણાવો. એક લીમીટેડ કંપનીનો ત્રણ ખામીવાળો ઓડીટ (15)
- અહેવાલ તૈયાર કરો.
- અથવા
- પ્રશ્ન-3 ઓડિટરની જવાબદારીને ધ્યાનમાં લઈ સારા ઓડિટ અહેવાલના લક્ષણો જણાવો. (15)
- પ્રશ્ન-4 ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) (15)
- (A) ગ્રીન ગવર્નન્સ કે પર્યાવરણ સુસંચાલન.
- (B) રેટિંગ એજન્સીના ફાયદા.
- (C) નૈતિક આચારસંહિતાની કમિટી.
- (D) કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ
- (E) કરાર નોંધણી કલમ-૪૯

ENGLISH VERSION

Que-1 (A) What is verification? State its objectives and Importance. (10)

(B) State the duties of an auditor towards verification and valuation of assets. (10)

OR

Que-1 How would you verify and Value the following. (Any Four) (20)

(1) Contingent liabilities (2) Patent (3) closing stock

(4) Goodwill (5) Investments (6) Mortgage Loan

Que-2 (A) What is divisible profit? State the factor affecting to divisible profit. (10)

(B) Describe the Dividend and Interim dividend. (10)

OR

Que-2 (A) Give the meaning of dividend and state the duties of an auditor towards dividend. (10)

(B) State the duties of an auditor regarding divisible profit in detail. (10)

Que-3 Describe the types of auditor's report in detail. Prepare an audit report of a limited company having three defects. (15)

OR

Que-3 State the characteristics of a good audit report by seeing the auditor's responsibilities. (15)

Que-4 Write short note. (Any three) (15)

(A) Green governance.

(B) Advantages of rating agency.

(C) Ethics committee.

(D) Corporate governance report.

(E) Listing Agreement Clause-49.
